

ત્વરિત જાહેરાત માટે

## AMO 2021 વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં સીટી ઓફ બ્રેમ્પટન: રિકવરી, આરોગ્ય, અને ભાવિ સમૃદ્ધિ માટે હિમાયત કરવી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 16, 2021) – ઓગસ્ટ 16 થી 18 સુધી, સીટી ઓફ બ્રેમ્પટનનું પ્રતિનિધિ મંડળ, 2021 એસોસિએશન ઓફ મ્યુનિસિપાલિટીસ (AMO) ની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં સહભાગી થશે. મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) ની આગેવાનીમાં, કાઉન્સિલના સભ્યો અને સીટી અધિકારીઓ બ્રેમ્પટન માટે સૌથી મહત્વના મુદ્દાઓ પર સમગ્ર પ્રોવિન્સના સરકારી મંત્રીઓ, અધિકારીઓ અને મુખ્ય હિતધારકો સાથે પ્રવૃત્તમય થશે.

આપણે COVID-19 વૈશ્વિક મહામારીમાંથી પસાર થઈ રહ્યાં છીએ ત્યારે, અગ્રતાઓમાં આપણાં સમુદાયની રિકવરી અને એકંદરે આરોગ્ય અને સુખાકારી જેવી બાબતો પર ભાર મૂકવામાં આવે છે. આમાં સામેલ છે:

- **સક્રિય પરિવહન** – સક્રિય પરિવહન યોજનાઓ વિસ્તારવી અને પ્રોત્સાહન આપવું, જેમાં સાઈકલિંગ માટે માળખાગત સગવડ અને ભંડોળ સામેલ છે
- **આબોહવામાં ફેરફાર અને જાહેર આરોગ્ય** – આરોગ્યપ્રદ પર્યાવરણ, અર્થતંત્ર, અને સમુદાયને ટેકો આપવા રોકાણો અને કાર્યનીતિમાં ફેરફારો કરવા પ્રોવિન્સની સરકાર સાથે ભાગીદારી કરવી
- **સેકન્ડ યુનિટ્સ** – પરવડી શક્તા આવાસીય વિકલ્પોની ઉણપને સંબોધવી અને બિલ્ડિંગ કોડમાં સુધારાની હિમાયત કરવી
- **આર્થિક વિકાસ અને રિકવરી** – આર્થિક રિકવરી મારફતે રોકાણ અને સહાયતા પૂરી પાડવી, અને બ્રેમ્પટનના ઇનોવેશન ડિસ્ટ્રિક્ટને પ્રોત્સાહન આપવું
- **ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર** – બિલ 42 પસાર કરીને ઓન્ટેરિયોની ભાંગલી-નૂટલી ઓટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ સુધારવાની, સસ્તાપણું સુધારવાની, અને કાયદાકીય પ્રક્રિયા વેગમય બનાવવાની હિમાયત કરે છે
- **સામુદાયિક સુરક્ષા હિમાયત** – માનસિક આરોગ્ય સહાયતામાં વધારો, સામુદાયિક સુરક્ષા માટે નવા અને હયાત સંસાધનો ઓળખવા, અને પીલ હાઉસિંગ માસ્ટર પ્લાન માટે ભંડોળ વધારવું
- **સેકન્ડરી પર્ચેસ તકો** – બ્રેમ્પટન યુનિવર્સિટી એક્ટ પસાર કરીને BramptonU અસ્તિત્વમાં લાવવા કાયદો પસાર કરવો અને બ્રેમ્પટનમાં રાયરસન મેડિકલ સ્કૂલ માટે આયોજન પ્રક્રિયા આગળ વધારવી
- **આવાસીય** – રહેવાસીઓ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને સસ્તા આવાસીય વિકલ્પોને સંબોધવા ઉકેલો અને કાર્યક્રમો વિકસાવવા, અને શહેરની માળખાગત સગવડ પર સંબંધિત પ્રભાવોની સમીક્ષા કરવી
- **આરોગ્ય સંભાળ** – શ્રેણીબદ્ધ આરોગ્ય સેવાઓ, પીલ મેમોરિયલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસનો તબક્કો II વિકસાવવા માટે તાત્કાલિક ભંડોળ, અને વ્યાપક કેન્સર કેર સેન્ટર માટે ઓસ્લરની સ્ટેજ 1 દરખાસ્તને મંજૂરી
- **ટ્રાન્ઝિટ** – વૈશ્વિક મહામારીમાંથી રિકવરી થવા અને સવારીઓની સંખ્યા (રાઈડરશિપને) COVID-19 પહેલાંના સ્તરોએ સુરક્ષિતપણે વધારવા ટ્રાન્ઝિટ સંચાલન માટે ભંડોળ
- **હાયર-ઓર્ડર ટ્રાન્ઝિટ** – પ્રવર્તમાન પહેલો; LRT એક્સટેન્શન, ક્વીન સ્ટ્રીટ-હાઈવે 7 BRT નો અભ્યાસ અને ટિવસભર, ટિવ-માર્ગીય GO ટ્રેઈન સર્વિસની સતત પ્રગતિ

સીટીની મહત્વની અગ્રતાઓ વિશે વધુ જાણવા, [અહીં](#) ક્લિક કરો.

**અવતરણો (ક્વોટ્સ):**

“ગયા વર્ષે આપણને સમુદાય, સમુદાયની તાકાત અને સહાયતા માટે તેઓની જરૂરિયાતો વિષે ઘણું શીખવ્યું છે. આપણે COVID-19 વૈશ્વિક મહામારી દરમિયાન આપણાં આરોગ્ય અને સુરક્ષા પર ધ્યાન આપવાનું ચાલુ રાખ્યું છે ત્યારે, આપણે કાર્યક્ષમ અને સમૃદ્ધ ભાવિ માટેનું આયોજન પણ કરી રહ્યાં છીએ – એવું બ્રેમ્પટન જે સફળતા, રોકાણ અને વૃદ્ધિ માટે સ્થાપિત થાય. હું પ્રોવિન્સે આ વર્ષે આપણને દેખાડેલી સહાયતા માટે અને આપણાં શહેરને સુધારવા માટે તેઓની કટિબદ્ધતા માટે આભારી છું. હું બ્રેમ્પટન માટે આપણું દૂરદેશીપણું ફળદાયી બનતું જોવા આ વેગને આગળ ધપાવવા, આપણાં પ્રોજેક્ટ્સ જીવંત બનતા જોવા અને આગળ ભાગીદારી કરવાનું ચાલુ રાખવા આશાવાદી છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનની ટીમે વૈશ્વિક મહામારી દરમિયાન તાકાત અને સ્થિતિસ્થાપકતા દેખાડવાનું ચાલુ રાખ્યું છે. તેઓએ શહેરને મજબૂત બનાવવા પ્રોજેક્ટ્સ અને પહેલો પ્રગતિમય બનાવતી વખતે સમુદાય આધારિત હોય તેવી ચાલુ સહાયતાઓ પહોંચાડી છે, જે આપણને સફળતા અને ગતિશીલ આર્થિક રિકવરી મેળવવાના સ્થાન પર રાખે છે. આપણાં પ્રોવિન્સના ભાગીદારો સાથે સહયોગ બ્રેમ્પટનના ઉજ્જવળ ભાવિ માટે અનિવાર્ય છે. હું કોન્ફિડન્સ દરમિયાન આપણાં સાથી કર્મચારીઓ સાથે પ્રવૃત્તમય રહેવા અને આ શહેર માટે સૌથી મહત્વની બાબત પર અવલંબિત રહેવા આશાવાદી છું.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક (MEDIA CONTACT):**

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)